

# Press Clipping

Publication : Vyapar (Gujarati)

Date : Saturday, November 01, 2008

Edition : Mumbai

Page : 3

Headline : Good opportunity to purchase shares of lowest rates : Large Cap IT Shares are attractive

## તળિયાના ભાવે પસંદગીના શેરો ખરીદવાની સુવર્ણ તક : આઈટીના પસંદગીના લાજકેપ શેરો ખૂબ આકર્ષક

ત્રણેતરમાં ભારતમાં બજાર નરમ રહેલ છે અને ચાલુ કેલેન્ડર વર્ષમાં નવું તળિયું જોવા મળ્યું છે.

આંતરરાષ્ટ્રીય બજારોની નબળાઈ અને યુએસ-યુરોપમાં વણસતી આર્થિક સ્થિતિ આના મૂળમાં છે. યુએસમાં બેન્કો-નાણાકીય સંસ્થાઓને કટોકટીમાંથી ઉગારવાનું પેકેજ હાસ્ય લાવી શક્યું નથી. તેના અમલની રીત અંગે શંકા સેવાય છે અને યુએસ અર્થતંત્રને મંદીની ગતિમાંથી બહાર કાઢવા આ પેકેજ અપૂરતું મનાય છે.

બીજી બાજુ ધિરાણ કટોકટી યુરોપમાં પ્રસરી છે. અમુક દેશોની સરકારોએ નાણાકીય સંસ્થાઓને ઉગારવા અને તેમની બેન્કિંગ સિસ્ટમમાં પ્રવાહિતા સુધારવા નાણાપેકેજ જાહેર કર્યા છે. અમુક નાણાકીય સંસ્થાઓની તંદુરસ્તી ગજાબહાર કઢાવી છે. અમુક ઊભરતાં બજારોમાંથી આથી નાણાં પાછાં ખેંચાઈ રહ્યાં છે અને તેનું આંશિક કારણ અન્ય ખોટ ભરપાઈ તેમ જ જોખમ નિવારવાનું છે. વિદેશી નાણાકીય સંસ્થાઓએ આ કેલેન્ડર વર્ષમાં ભારતીય ઈક્વિટી બજારોમાંથી લગભગ ૯ અબજ ડોલર પાછા ખેંચી લીધા છે.

સ્થાનિક પરિબળો જોઈએ તો છેલ્લાં ચાર-છ અઠવાડિયાંથી ફૂડ અને કોમોડિટી ભાવો ઘટવા ઉપરાંત વ્યાજદર અને ફુગાવાના ક્ષેત્રે સ્થિતિ થોડીક સુધરી છે. વૈશ્વિક માગ ઘટવાની ધારણાએ ફૂડતેલના ભાવ

ઘટી બેન્ક ટીક દર ડોલરથી નીચે આવી ગયા છે. વિકસિત દેશોનાં અર્થતંત્રની ગતિ ધીમી પડી જવાથી સોફ્ટ અને હાર્ડ કોમોડિટીના ભાવો તીવ્રપણે ઘટ્યા છે. આથી ફુગાવાનો દર ૧૨ ટકા નીચે આવી ગયો છે. ફુગાવો ઘટવાથી અને વિકાસદરની વૃદ્ધિ થોડીક મંદ પડવાથી હવે વ્યાજદર સામકલ લગભગ વધશે નહીં.

આંતરરાષ્ટ્રીય પરિબળોની ભારત પર અને ભારતીય અર્થતંત્રના વિકાસદર પર થનારી અસર થોડીક ચિંતા ઉપજાવે છે. ઓગસ્ટનો ઔદ્યોગિક ઉત્પાદનનો આંક ૧.૧ ટકાની નીચી સપાટીને સ્પર્શેલ છે, જે ચિંતાજનક છે. ૨૦૦૮ના મુકાબલે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી

વિકાસદર ધીમો પડશે એમ મનાય છે. ઊંચા વ્યાજના દરના પરિણામે અને આંતરરાષ્ટ્રીય નબળી પડેલી માગના પરિણામે જીડીપી વિકાસદર ધીમો પડ્યો છે. માગઆધારિત મંદ ગતિ અંગે આપણે સાવચેત રહેવાનું છે. આરબીઆઈ વ્યાજદર અંગે સક્રિય છે અને એથી આગામી મહિનાઓમાં ફુગાવો અનુકૂળ સપાટીએ રહેનાર છે.

વર્તમાન સેન્સેક્સ લેવલ જે છે તે નાણાકીય વર્ષ ૨૦૦૯ના કમાણીના અંદાજો ૧૧ ટકા જેટલા ડિસ્કાઉન્ટિંગ કરે છે, જેની વધુ માગ નથી. નાણાકીય વર્ષ ૨૦૧૦માં વિકાસ ધીમો પડશે અને નાણાકીય વર્ષ ૨૦૧૦ આધારિત વેલ્યુએશનના અંદાજો અત્યારે અનડિમાન્ડિંગ લાગે છે.

મધ્યમ-થી-લાંબા ગાળાના સંયોગો ધ્યાનમાં રાખી સારા શેરોમાં રોકાણ કરવા માટે અત્યારે અનુકૂળ સમય છે. જે કંપનીના ફન્ડામેન્ટલ સારા હોય, મેનેજમેન્ટ ટીમ મજબૂત હોય અને જે શેરો વાજબી ભાવે મળતા હોય તેવી કંપનીઓ ધ્યાનમાં રાખવી જોઈએ. આમ છતાં ટૂંકા ગાળાના સંયોગો જોઈએ તો આંતરરાષ્ટ્રીય ખાનાખરાબી થકી બજારમાં વધુ નબળાઈ અને વધુ ચંચળતા જોવાશે. સાવ તળિયાના ભાવે ખરીદી કોઈ કરી શકતું નથી. આથી આ શેરોમાં ધીમેધીમે રોકાણ કરતાં જવાની અમે ભલામણ કરીએ છીએ.



દીપેન શાહ  
(કોટક સિક્યુરિટીઝ)

બેન્કિંગ, લોજિસ્ટિક્સ, બાંધકામ, કેપિટલ ગુડ્સ, મીડિયા જેવાં ક્ષેત્રના પસંદગીના શેરો આકર્ષક જણાય છે. અમુક શેરો ઘણા પટકાયાં છે અને હવે નીચા વ્યાજદરના કારણે તે સારો દેખાવ કરશે એમ મનાય છે. વ્યાજદર અને કોમોડિટી (કાચી સામગ્રી) બાબત આ બધાં ક્ષેત્રો ઉર્મિશીલ છે. વ્યાજદર અને કોમોડિટી ભાવો અનુકૂળ રહેવાની ધારણા હોવાથી આ બધાં ક્ષેત્રોને ફાયદો થવાનો છે. આઈટીના વધુ પસંદગીના લાજકેપ શેરો ઘણા જ આકર્ષક જણાય છે. વર્તમાન બજારમાં રોકાણ કરતી વેળા મીડિયમથી લાંબા ગાળાના સંયોગો ધ્યાનમાં રાખો અને ચૂઝી બનો.